

HWDSB

પ્રિય પરિવારો,

હેમિલ્ટન-વેન્ટવર્થ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (HWDSB) ખાતે વિદ્યાર્થીઓ દરરોજ સલામત રીતે શાળાએ પહોંચે તે સુનિશ્ચિત કરવું એ અમારી સૌથી મહત્વની પ્રાથમિકતાઓ પૈકીની એક છે.

ગેરહાજરીઓ અંગેની અમારી પ્રક્રિયાઓને મજબૂત કરવા અમે એક પદ્ધતિ **SafeArrival (સેફ એરાઈવલ)** દાખલ કરી રહ્યા છીએ, જે તમારા માટે ગેરહાજરીઓની જાણ કરવાનું ખૂબ સહેલું બનાવશે. તે શાળાના કર્મચારીઓને તમામ અસ્પષ્ટ ગેરહાજરીઓનો ઝડપથી અને સંપૂર્ણ રીતે પ્રતિભાવ આપવાની છુટ આપશે. અમારું ધ્યેય છે કે તમામ ગેરહાજરીઓ સ્પષ્ટ થયેલી હોય અને દરેક દિવસ માટે તમામ વિદ્યાર્થીઓની ગણતરી, એ સૌ સલામત છે એ જાણીને, થયેલી હોય.

SafeArrival વડે પરિવારો બાળકની ગેરહાજરીની જાણ ત્રણ રીતે કરી શકશે:

1. SafeArrival વેબસાઈટ, go.schoolmessenger.ca નો ઉપયોગ કરો. તમે વેબસાઈટનો પ્રથમ વખત ઉપયોગ કરો, ત્યારે તમારું ખાતું ખોલાવવા **Sign Up (સાઈન અપ)** પસંદ કરો. **Attendance (એટેન્ડન્સ)** પસંદ કરો પછી **Report an Absence (રિપોર્ટ એન એબ્સન્સ)** પસંદ કરો.
2. તમારા મોબાઈલનો ઉપયોગ કરીને એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર (અથવા go.schoolmessenger.ca માંની લિંક્સથી) **SchoolMessenger** એપને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો. એપનો તમે પ્રથમ વખત ઉપયોગ કરો, ત્યારે તમારું ખાતું ખોલાવવા **Sign Up (સાઈન અપ)** પસંદ કરો. **Attendance (એટેન્ડન્સ)** પસંદ કરો પછી **Report an Absence (રિપોર્ટ એન એબ્સન્સ)** પસંદ કરો.
3. ગેરહાજરીની જાણ કરવા, નિ:શુલ્ક ફોન નંબર 844-506-4350 ની સ્વચાલિત ફોન પદ્ધતિનો ઉપયોગ કરીને, ફોન કરો.

આ વિકલ્પો દરરોજ/24 કલાક, સપ્તાહના સાતેય દિવસ ઉપલબ્ધ હોય છે. તમે ભવિષ્યની ગેરહાજરીની જાણ કોઈપણ સમયે કરી શકો છો.

તે ઉપરાંત, જે બાળકની ગેરહાજરીની જાણ અગાઉથી નહીં થઈ હોય એવા વાલીઓનો સંપર્ક કરવા, અમે અધિસૂચના આપવાની સ્વચાલિત પદ્ધતિ **SchoolMessenger Communicate (સ્કૂલ મેસેન્જર કોમ્યુનિકેટ)**નો ઉપયોગ કરીશું. અધિસૂચના આપવાની આ સ્વચાલિત પદ્ધતિ, જ્યાં સુધી ગેરહાજરીની પુષ્ટિ અને ખુલાસો નહીં થાય ત્યાં સુધી વાલીઓનો સંપર્ક કરવા વારંવાર પ્રયત્ન કરશે. જો નિયત કરાયેલા સંપર્ક સુધી આ પદ્ધતિથી નહીં પહોંચી શકાય, તો શાળાના કર્મચારીઓ આગળની કાર્યવાહી કરશે.

જો તમે તમારા બાળકની ગેરહાજરીની આગોતરી જાણ, **SafeArrival**ના નિ:શુલ્ક નંબર, વેબસાઈટ અથવા મોબાઈલ એપ વડે કરી હશે, તો તમને આ અધિસૂચના નહીં મળે.

HWDSB

મહેરબાની કરીને **23 એપ્રિલ, 2019** થી, ગેરહાજરીઓની જાણ ચિઠ્ઠી મોકલીને અથવા શાળાને ફોન કરીને/ઈમેઈલ મોકલીને કરવાને બદલે **SafeArrival** નો ઉપયોગ કરીને કરશો. જો તમારું બાળક ગેરહાજર હશે, તો કર્મચારીઓ **SafeArrival** નો ઉપયોગ કરીને, આ તારીખથી, તમને અધિસૂચના મોકલવાનું શરૂ કરશે (જો તમે ગેરહાજરીની આગોતરી જાણ નહીં કરી હોય તો).

જો તમારા કોઈ પ્રશ્નો હોય તો તમારી શાળાના કાર્યાલય અથવા આચાર્ય સાથે વાત કરો. વધુ સંસાધનો bit.ly/safearrivalHWDSB ખાતે **SafeArrival** ઉપર અને શાળાની વેબસાઈટ પર જોઈ શકો છો.

અમે આ નવી પધ્ધતિનો અમલ શરૂ કરીએ છીએ ત્યારે તમારા ઘેર્ય અને સહકાર બદલ આભાર.